

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા MSME સેક્ટર માટે વિશાળ રાહત પેકેઝ જાહેર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ સૂચનો રજૂ કરવામાં આવેલ.

વિશ્વવ્યાપી કોરોના વાઈરસના કહેર સબબ સમગ્ર દેશ લોકડાઉનના તબક્કામાં પસાર થઈ રહ્યો છે ત્યારે તમામ ઔદ્યોગિક, વ્યાપારિક, નિકાસકર્તાઓ તથા સેવા પ્રદાન કરતા એકમો ભયંકર નાણાકીય, વહિવટી અને હિસાબી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા ઔદ્યોગિક એકમોને ભોગવવી પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિશાળ રાહત પેકેજ જાહેર કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ વિવિધ મુદ્દાઓથી રજૂઆત કરવામાં આવેલ છે.

- (૧) રાજ્ય સરકાર દ્વારા વસુલાતા વિવિધ ટેક્સ તથા ડ્યુટીઝ આગામી ૬ મહિના માટે રદ કરવા.
- (૨) એકમો દ્વારા લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન કર્મચારી તથા મજૂરોને પગાર તથા અન્ય ભથ્થા પેટે ચુકવવાપાત્ર કરોડો રૂપિયાનો બોજો સહન કરી શકે તે માટે પ્રેરણાદાયી પ્રોત્સાહન યોજના સત્વરે જાહેર કરવી. વિશ્વના ઇતિહાસમાં જોવા મળેલી અતિ પ્રચુર આર્થિક મહામારીના નીરમલુંન માટે રાજ્યનાં કુલ GDP ની ૧૦% રકમ પ્રોત્સાહન પેટે ચુકવવાની માનનીય મુખ્યમંત્રીશ્રીને ભારપૂર્વક તથા અસરકારક રજૂઆત કરવામાં આવેલ છે.
- (૩) તમામ એકમોને આગામી ૬ માસ માટે કર્મચારી ભવિષ્યનીધી, ESIA PF, બોનસ તથા અન્ય નિયત ચુકવણીમાં મુક્તિ આપવામાં આવે.
- (૪) અનિશ્ચિત ખર્ચાઓ જેવા કે, બેન્ક વ્યાજ, વિજબીલ, વિમા રકમ, વાર્ષિક લઘુત્તમ ચાર્જીસ વગેરે માંથી ૬ માસ માટે મુક્તિ આપવામાં આવે.
- (૫) GST તથા IGST હેઠળ એકમોને મળવાપાત્ર રિફંડ તથા વળતર ત્વરિત ચુકવવામાં આવે તથા રાજ્ય દ્વારા વસુલાતી આવી રકમમાં ખાસ કિસ્સા તરીકે ૬ માસ માટે ૫% સબસીડી ચુકવવામાં આવે.
- (૬) ધંધાકીય વિકાસ અને વિસ્તાર માટે એકમો દ્વારા કરવાપાત્ર વિદેશયાત્રા અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં હાજરી આપવા વગેરે પર કરવાપાત્ર ખર્ચ પેટે પ્રતિ યુનિટ / પ્રતિ વર્ષ રૂ.૨૦ લાખ સુધીની પ્રોત્સાહક રકમ ચુકવવી.
- (૭) એકમો દ્વારા ધંધાકીય વિકાસ તથા ઉત્કર્ષ માટે થનાર મુડી ખર્ચ જેમ કે હયાત એકમનું વિસ્તરણ કરવું, વધારાની મશીનરી વસાવવી, બિલ્ડીંગનો વ્યાપ તથા વિસ્તાર વધારવો વગેરે સંજોગોમાં થનાર ખર્ચના ૧૫% સુધીની રકમ સબસીડી તરીકે ચુકવવી.
- (૮) ઔદ્યોગીકરણને સહાય તથા સમર્થન પુરું પાડવા માટે વિકસાવેલ જીઆઈડીસીને એકમો દ્વારા ચુકવવાપાત્ર માસિક હપ્તા વગેરે ૬ માસ માટે સ્થગિત કરવામાં આવે.

(९) GST નાં અમલીકરણ પહેલા હયાત વેટ (VAT) અંતર્ગત બાકી રહેલા તકરારી કિસ્સાઓનું યોગ્ય નિરાકરણ લાવવું.

(૧૦) તમામ એકમોને પ્રોપર્ટી ટેક્ષની ચુકવણી માંથી ૬ માસ માટે મક્કિત આપવી.